



વડોદરા મહાનગરપાલિકા

“વ્યવસાય વેરા સમાધાન યોજના-૨૦૨૨ “

આકારણી શાખા

વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ વ્યવસાયીઓ અને નિયોક્તાઓને વ્યવસાય વેરો ભરવાનો બાકી રહી ગયેલ હોય તેવા કરદાતાઓ માટે વ્યવસાય વેરા સમાધાન યોજના -૨૦૨૨ અમલમાં મુકવામાં આવેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

૧. સદર યોજના તા.૦૬-૧૦-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે
(અ) બિન નોંધાયેલ વ્યવસાયીઓ માટે: ઉપરોક્ત સમય ગાળા દરમ્યાન નિયત દરે ભરવાપાત્ર રકમ ચૂકવે તો વ્યાજ,દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપી એનરોલમેન્ટ પ્રમાણપત્ર આપવામાં આવશે.

(બ) નોંધાયેલ વ્યવસાયીઓ માટે:જેટલા વર્ષનો વ્યવસાયવેરો બાકી હોય તેટલા વર્ષની વ્યવસાય વેરાની રકમ નિયત દરે ચૂકવીને સદર યોજનાના સમય દરમ્યાન નિયત નમુનામાં અરજી કરે તો તેઓને વ્યાજ,દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

(ક) બિન -નોંધાયેલા નિયોક્તાઓ(એમ્પ્લોયર)માટે: આ યોજના દરમ્યાન રજીસ્ટ્રેશન મેળવવા માટે અરજી કરે અને નિયત દરે ભરવાપાત્ર રકમ ચૂકવે તો તેઓને વ્યાજ,દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિઆપી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે.

(ડ) નોંધાયેલ નિયોક્તાઓ (એમ્પ્લોયર)માટે : કામે રાખનાર નિયોક્તાઓએ તેમનાં વેતનદારો પસેથી વ્યવસાયવેરો ઉઘરાવેલ હોય પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં જમા ન કરાવેલ હોય તેઓએ વ્યવસાય વેરાની રકમ માસિક ૧.૫%લેખે વ્યજની રકમ સહિત ચૂકવે તો તેઓને દંડકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આકશે અથવા નિયોક્તાઓએ વેરો ઉઘરાવેલ ન હોય તો તે ભરે તો તેઓને વ્યાજ અને દંડકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

સદર યોજના હેઠળ રાહત મેળવવા નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. યોજનાની વિગતવાર માહિતી તેમજ નમુનાનાં અરજી પત્રક વડોદરા મહાનગરપાલિકાની વેબ સાઇટ www.vmc.gov.in પરથી મળી શકશે. વધુ વિગતો/જાણકારી/સમજ મેળવવા માટે કચેરીનાં કામકાજનાં સમયમાં સંબંધિત વોર્ડની કચેરીમાં સંપર્ક કરવા તમામ કરદાતાઓને જણાવવામાં આવે છે.

પી.આર.ઓ.નં. ૭૫૭ /૨૦૨૨-૨૩

મ્યુનિસિપલ કમિશનર

પત્રક - ૧

બિન-નોંધાયેલ વ્યવસાયીઓ /નિયોક્તાઓ માટે અરજી પત્રક

વ્યવસાય વેરા સમાધાન યોજના-૨૦૨૨

તા.૦૬/૧૦/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી

(વ્યવસાય વેરા સમાધાન યોજના-૨૦૨૨ અન્વયે લાભ લેનાર બિન-નોંધાયેલ
નિયોક્તા/વ્યવસાયીએ આપવાનું એકરારનામું)

પ્રતિ,

વોર્ડ ઓફીસરશ્રી,

વોર્ડ નં.

વડોદરા મહાનગર પાલિકા

વિષય: વ્યવસાય વેરા સમાધાન યોજના-૨૦૨૨ હેઠળ લાભ લેવા માટે અરજી

આથી હું નીચે સહી કરનાર ગુજરાત રાજ્ય, વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ અન્વયે રજીસ્ટ્રેશન / એનરોલમેન્ટ મેળવવા જવાબદાર થાઉં છું.

ગુજરાત સરકારે તા.૦૬/૧૦/૨૦૨૨ના ઠરાવ ક્રમાંક : ૫૬૮/૧૦૨૦૨૨-૧૦૭૫૬ અન્વયે બહાર પાડેલ વ્યવસાય વેરા સમાધાન યોજના -૨૦૨૨ અન્વયે હું લાભ મેળવવા ઈચ્છુ છું.

આથી હું પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે, ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ની જોગવાઈઓ અન્વયે રજીસ્ટ્રેશન / એનરોલમેન્ટ મેળવવા અને વ્યવસાય વેરો ભરવાની મારી જવાબદારી તા. ઉપસ્થિત થાય છે. સદર તા. થી તા. સુધીમાં ઉક્ત અધિનિયમ હેઠળ વખતો-વખત નિયત કરેલ દર મુજબ વ્યવસાય વેરા પેટે રૂ. રકમ ભરવાપાત્ર થાય છે. આવી રકમ તા..... ના રોજ ભર્યા અંગેનું ચલણ આ સાથે રજૂ કરું છું.

મારી આ સ્વૈચ્છિક જાહેરાત સ્વીકારી સમયસર નોંધણી ન મેળવવા બદલ ક્ષતિ માફ કરી દેડ તથા વ્યાજ મુક્તિની રાહત આપી મને નોંધણી નંબર આપવા વિનંતી છે. આ સાથે રજીસ્ટ્રેશન માટે નિયત નમુનો- ૧ એનરોલમેન્ટ માટે નિયત નમૂના -૩ (જે લાગુ પડે તે સિવાયનું છેકી નાખો). આપને સાદર કરું છું.

સ્થળ:

સહી.....

તારીખ:

નિયોક્તા/વ્યવસાયીનું નામ-સરનામું:

પત્રક - ૨

નોંધાયેલ વ્યવસાયીઓ /નિયોક્તાઓ માટે અરજી પત્રક

વ્યવસાય વેરા સમાધાન યોજના-૨૦૨૨

તા.૦૬/૧૦/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી

(વ્યવસાય વેરા સમાધાન યોજના-૨૦૨૨ અન્વયે લાભ લેનાર નોંધાયેલ નિયોક્તા/વ્યવસાયીએ
આપવાનું એકરારનામું)

પ્રતિ,

વોર્ડ ઓફીસરશ્રી,

વોર્ડ નં.

વડોદરા મહાનગર પાલિકા

વિષય: વ્યવસાય વેરા સમાધાન યોજના-૨૦૨૨ હેઠળ લાભ લેવા માટે અરજી

આથી હું નીચે સહી કરનાર ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ અન્વયે એનરોલમેન્ટ સર્ટિફિકેટ/રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નંબરધરાવું છું અને ઉક્ત વેરો ભરવા જવાબદાર છું.

ગુજરાત સરકારે તા.૦૬/૧૦/૨૦૨૨ના ઠરાવ ક્રમાંક : ૫૬૮/૧૦૨૦૨૨-૧૦૭૫૬ અન્વયે બહાર પાડેલ વ્યવસાય વેરા સમાધાન યોજના -૨૦૨૨ અન્વયે હું લાભ મેળવવા ઈચ્છુ છું.

આથી, હું પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ની જોગવાઈ મુજબ

(૧) તા. થી તા. સુધીના નિયત કરેલ દર મુજબ મેં વેરો ઉઘરાવી ભરેલ ન હોઈ વ્યવસાય વેરા પેટે રૂ. તથા વ્યાજ પેટે રૂ. ભરવા જવાબદાર છું. આવી રકમ તા.ના રોજ ભર્યા અંગેનું ચલણ આ સાથે રજુ કરું છું.

અથવા

(૧) તા. થી તા. સુધી નિયોક્તા તરીકે મેં વેરો ઉઘરાવેલ નથી કે ભરેલ નથી. આથી વ્યવસાય વેરા પેટે રૂ. ભરવા જવાબદાર છું. આવી રકમ તા.ના રોજ ભર્યા અંગેનું ચલણ આ સાથે રજુ કરું છું.

મારી આ રજુઆત સ્વીકારી સમયસર વેરો ન ભરવા બદલ ક્ષતિ માફ કરી દંડ માફ કરવા વિનંતી છે.

(૨) તા. થી તા. સુધી વ્યવસાયી તરીકે નિયત કરેલ દર મુજબ હું વ્યવસાય વેરા પેટે રૂ. ભરવા જવાબદાર છું. આવી રકમ તા.ના રોજ ભર્યા અંગેનું ચલણ આ સાથે રજુ કરું છું.

મારી આ રજુઆત સ્વીકારી સમયસર વેરો ન ભરવા બદલ ક્ષતિ માફ કરી વ્યાજ તથા દંડ માફ કરવા વિનંતી છે.

સ્થળ:

સહી.....

તારીખ:

નિયોક્તા/વ્યવસાયીનું નામ-સરનામું: